

# RAN-2108002201070010

F. Y. B.Com. (External) Examination March - 2026

Elements of Banking & Insurance

## સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.  
Fill up strictly the above details on your answer book.

Seat No.:

|  |  |  |  |  |  |
|--|--|--|--|--|--|
|  |  |  |  |  |  |
|--|--|--|--|--|--|

Student's Signature

પેપર - 1

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ આપો.

20

- સાર્વત્રિક જીવન વીમો અને સમગ્ર જીવન વીમો વચ્ચે શું તફાવત છે?
- કામદારોના વળતરની પ્રિમિયમની ગણતરી ને અસર કરતાં પરિબળો જણાવો.
- માર્ગાન્તર એટલે શું?
- આગનો વીમો એટલે શું?
- મોટર વાહનવીમાનો પ્રાથમિક હેતુ શું છે?
- વીમાક્ષેત્ર પર નિયંત્રણ રાખવા કેન્દ્ર સરકારે ક્યારે અને કઈ સંસ્થાની સ્થાપના કરી?
- સાદા કોસ્સિંગ માટેની શરતો જણાવો.
- Aeps ના ઉદ્દેશો જાણાવો.
- ચેક ડિપોઝિટ મશીન એટલે શું?
- મોબાઈલ બેન્કિંગમાં ફિશિંગ એટલે શું?

પ્રશ્ન 2. વીમાના લક્ષણો વર્ણવો.

16

અથવા

ભારતમાં કામદારોની વળતરવીમા પોલિસીની આવશ્યકતા સમજાવો.

16

પ્રશ્ન 3.(અ) દરિયાઈવીમાની શરતોમાં જહાજની સમુદ્રયોગ્યતા અને સફરની કાયદેસરતા સમજાવો.

08

(બ) આગનો વીમો લેવાની કાર્યવાહી સમજાવો.

અથવા

(અ) વીમાના ખાનગીકરણની મર્યાદાઓ સમજાવો.

08

(બ) ભારતમાં ઉપલબ્ધ વાહનવીમાના પ્રકારો સમજાવો.

08

પ્રશ્ન 4. ચેકના લક્ષણો અને ફાયદાઓ વર્ણવો.

16

અથવા

ઈન્ટરનેટ બેન્કિંગથી થતાં લાભો અને બેન્કિંગ સંદર્ભે જોખમના પ્રકારો સમજાવો.

16

પ્રશ્ન 5. સમજાવો - CTS 16

અથવા

મોબાઈલ બેન્કિંગથી મળતી સુવિધાઓ વર્ણવો.

પ્રશ્ન 6. ટૂંકનોંધ લખો. (કોઈ પણ બે) 16

1. વીમાનો વીમાયોગ્યહીતનો સિદ્ધાંત
2. જીવનવીમો લેવાની રીત
3. મોબાઈલ બેન્કિંગથી ફાયદા
4. વીમાનું મહત્વ

### ENGLISH VERSION

Paper:- 1

Q. 1. answer in brief. 20

1. What is difference between universal life insurance and whole life insurance?
2. State the factors affecting the calculation of workers compensation premium.
3. What is transit?
4. What is fire insurance?
5. What is the primary purpose of the motor vehicle insurance?
6. When and which organization established by the central government to control the insurance sector?
7. State the conditions for simple crossing.
8. State the objection of Aeps.
9. What is check deposit machine?
10. What is fishing in mobile banking?

Q. 2. Describe the characteristics of insurance. 16

OR

Explain the necessity of workers compensation insurance policy in India. 16

Q. 3. (A) Explain the conditions of marine insurance the ships sea worthiness and legitimacy. 08

(B) Explain the procedure of taking fire insurance. 08

OR

(A) Explain the objective of privatization in insurance sector. 08

(B) Explain the types of insurance of motor available in India. 08

Q. 4. State the characteristics and advantages of the check. 16

OR

Explain the advantages of internet banking and the type of risk in the context of banking. 16

Q. 5. Explain the CTS 16

OR

Which facilities are provided by mobile banking? 16

Q. 6. Short notes (any two) 16

1. Principle of insurable interest
2. Process of taking life insurance
3. Advantages of mobile banking
4. Importance of insurance